

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૦૬/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૯૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૬ કેસ કરી, ૫૧ વ્યક્તિઓને ઝડપી, ૩૩૬ લીટર દેશી દારૂ, ૧૪૦ બોટલ ઇંગ્લીશ દારૂ, ૫૭૦ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૨૯૧ બિયર ટીન, ૧ કાર અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૬૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩,૨૯,૧૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૯૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૦૯૫/૧૮

વાસણા : હેતલબહેન ડો/ઓ કૃષ્ણદત્ત અગ્રવાલ (રહે,સદાનંદ સોસાયટી ટેલીફોન એક્ષચેન્જ ની પાછળ વાસણા) એ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે જુન/૨૦૧૬ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી નિતેશકુમાર દિનેશકુમાર પાંડે (રહે.વોડનંબર-૨૫ તિર્થરાજ ભવન નહેરુગંજ ઈટારસી મધ્યપ્રદેશ) એ હેતલબહેન સાથે પોતે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી, પોતાન અંગત ખર્ચા સારૂ, ચીજવસ્તુઓ ખરીદવા માટે તેમજ પોતાને કેન્સરનું ટ્યુમર હોવાનું અને હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાનું જણાવી સારવાર કરવાના બહાના બતાવી, જુદી-જુદી તારીખોએ ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૯.૭૫.૪૬૬/- મેળવી લઈ, પૈસા પરત નહી આપી તેમજ લગ્ન પણ નહી કરી, હેતલબહેન સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.એમ.પટેલ ચલાવે છે.

નરોડા : પ્રદિપસિંહ ચંદનસિંહ વાઘેલા (ઉ.વ.૩૫)(રહે,નંદનવન ડુપ્લેક્ષ, જી.ઇ.બી.પાછળ, નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૨૩/૧૨/૧૬ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ વાઘેલા (રહે,૧૦મો માળ, સારથી ટાવર, ધરણીધર) (૨)કલ્પેશભાઈ પ્રભુદાસ શેઠ અને (૩) કાજલ કલ્પેશભાઈ શેઠ (રહે.પાંચમો માળ, ગાર્ડન રેસીડન્સી, બોપલ) ભેગામળી પ્રદિપસિંહ ને એફ.સી.આઇ. મા સારી નોકરી આપવાની લાલચ આપી, વિશ્વાસમા લઈ, તેમની તથા તેમના મિત્ર વર્ધમાનસિંહ હઠીસિંહ મોરી એમ બંને પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા.૩૭,૦૦,૦૦૦/- મેળવી, તા.૧/૪/૧૭ ના રોજ એફ.સી.આઇ.નો બનાવટી સિક્કાવાળો એપોઇમેન્ટ લેટર બંને ને આપી, બંને સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે.આ ગુનાની તપાસ પોસઈ.શ્રી કે.આર.બામણિયા ચલાવે છે.

ઘાટલોડીયા : જડીબહેન W/O હિરાભાઇ પટેલ (ઉ.વ.૭૩)(રહે,તરૂણનગર સોસાયટી વિભાગ-૨ ગુરુકુળ રોડ મેમનગર) એ ઘટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૬/૧૮ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે ગુરુકુળ રોડ સરકારી વસાહત ત્રણ રસ્તા ઉપર થી ચાલતા પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરના) જડીબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.આર.ડાંગર ચલાવે છે.

શહેરકોટડા : રાહુલભાઇ હિંમતભાઇ ભાદાણી(પટેલ)(ઉ.વ.૨૯)(રહે,વિષ્ણુપાર્ક સોસાયટી, ઠક્કરબાપાનગર રોડ માધવમોલની અંદર ઠક્કરબાપાનગર) એ તા.૧૦/૬/૧૮ નારોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૫/૧૮ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે અમદુપુરા ચામુંડાબ્રીજ ખાતે રોડ ઉપર થી ચાલતા પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રાહુલભાઇ ના ફોઇ સાસુનો સોનાનો દોરો કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.આઇ.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા :-

ગોમતીપુર : મનુભાઈ ઇશ્વરભાઈ પટેલીયા (ઉ.વ.૬૫)(રહે.સંતરામપુરાની ચાલી, ગોમતીપુર) તા.૦૯/૦૬/૧૮ ના કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે ગોમતીપુર અશોકનગર સોસાયટી પાસે એસીડ પીધેલી હાલતમા મળી આવતા, સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તા.૦૯/૦૬/૧૮ રાતના ૧૦/૧૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એમ ડામોર ચલાવે છે.

શહેરકોટડા :- મુકેશભાઈ ગિરધરભાઈ ડોડીયા (ઉ.વ.૪૦)(રહે,કલેક્ટર કસ્ટોડીયલ ની ચાલી સરસપુર) એ તા.૧૦/૦૬/૧૮ ના કલાક ૦૨/૨૫ વાગ્યાના સુમારે ગંભીર બીમારીના કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિલીપકુમાર વસંતલાલ ચલાવે છે.

નારોલ :- હર્ષ સ/ઓ રજનીકાન્ત પટેલ (ઉ.વ.૨૪)(રહે,મર્લીન સ્પર્શ ફ્લેટ શ્રીરામ રેસિડેન્સીની બાજુમાં નારોલ) એ તા.૧૦/૦૬/૧૮ સાંજના ૪/૧૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાની માનશીક બીમારીથી કંટાળી જઇ પોતાના ઘરે છતના પંખાના હુકમાં દોરડુ બાધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી બ્રીજરાજસિંહ દિલીપસિંહ ચલાવે છે.

સરખેજ :- પ્રકાશભાઈ સ./ઓ રતુભાઈ મેર (ઉ.વ.૩૨)(રહે,હીરાનગર સોસાયટી ખોડીયારનગર સામે નવા વણઝર સરખેજ) એ તા.૦૭/૦૬/૧૮ સાંજના ૫/૧૦ વાગ્યાના સુમારે અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૯/૦૬/૨૦૧૮ રાતના ૮/૪૫ વાગે ફરજ પરના ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે સરખેજ પોલીસે અક્સ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી શૈલેન્દ્રસિંહ મનુભા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.